https://archive.org/details/bk1387/page/n0/mode/1up

2012-11-14 -Bharat Sadhu Samaj Virodh -Pirana Sammelan -Sandesh (1387)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

ધોકા, છરી, ધારીયા, તલવાર વડે તૂટી પડ્યા

...બીમાં જુની દુશ્મનાવટમાં યુવાન ઉપર જીવલેણ હુમલો

(સંદેશ બ્યુરો) મોરબી તા. ૧૩ ... મોરબીના મકરાણી વાસના રહેતા ઠાકોર યુવાન ... ચૌદશની રાત્રે જુના વેરઝેરનો ખાર ... શખ્સોએ ધોકા, છરી, ધારીયા, તલવાર જેવા ઘાતક શસ્ત્રોથી જીવલેણ હુમલો કરી રામચોક નજીક ગાડીમાંથી ફેંકીને નાસી છુટયા બાદ બેશુધ્ધ થયેલા ઠાકોર યુવાનને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો છે.

...શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

...ગ્રસ્ત યુવાનની ... ચારેય હુમલાખોરો ... નોંધી તપાસનો ... છે. ... નાની બજારમાં આવેલા ખત્રીવાડ અને મકરાણી વાસમાં રહેતા અમીત જયંતીભાઈ ઠાકોર નામના યુવાન પર ગઈરાત્રે કાલીકાપ્લોટ વિસ્તારમાં રહેતા હનીફ ગુલામમીર, અસલમ સલીમ સંધી, ઈસ્માઈલ આદમ ખેરાજી અને મુસ્તાક ગુલામમીરે અમીતે અગાઉના જુના વેરઝેરનો ખાર રાખી ઉપરોકત ચારેય શખ્સો છરી, તલવાર, ધારીયું અને ધોકા જેવા હથીયારોથી ઠાકોર યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવાન બેશુધ્ધ થઈ જતા ચારેય શખ્સો ગાડીમાં બેસાડીને બેશુધ્ધ હાલતમાં રામચોક વિસ્તારમાં ફેકીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ગંભીર ઈજા પામેલા ઠાકોર યુવાનને બેશુધ્ધ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો. પોલીસે તેની ફરીયાદ નોંધીને ચારેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્નકૂટ : નૂતનવર્ષની પૂર્વ સંધ્યાએ છારોડી ગુરૂકુળમાં ૧૦૮ પ્રકારની વાનગીઓનો અન્નકૂટ ઠાકોરજીને ધરવામાં આવ્યો હતો. માધવપ્રિયદાસજી અને પુરાણી બાલકૃષ્ણદાસજીએ આરતી ઉતારી દર્શન ખૂલ્લા મુકયા હતા. અન્નકૂટનો પ્રસાદ હોસ્પિટલ અને ગરીબોને વહેંચવામાં આવશે.

નૂતન વર્ષ ૨૦૬૯ના શુભ મુહૂર્તો

આજે બુધવાર, તા. ૧૪ નવેમ્બરે વિક્રમ સંવત ૨૦૬૯નો પ્રારંભ થશે. બેસતું વર્ષ છે. ગોવર્ધનપૂજા- અન્નકૂટ માટે ઉત્તમ દિવસ છે. અમૃતસિદ્ધિ યોગ બપોરે ૧૨.૧૪ કલાકથી શરૂ થતાં શુભ કાર્ય પ્રારંભ માટે ઉત્તમ મુહૂર્ત છે. મિતિ નાખવી. ઉદ્દ્ઘાટન, વેપાર પ્રારંભ અને શુભ કાર્ય પ્રસંગ માટે સવારે ૭.૦૦ કલાકથી ૮.૨૦ કલાકનો સમય શ્રેષ્ઠ છે. ૮.૨૪ ક.થી ૯.૫૪ કલાક પણ શુભ સમય છે. સવારે ૧૧.૨૪ કલાકથી ૧.૫૪ કલાક પણ શુભ સમય મળે છે. સાંજે ૭.૨૪ કલાકથી ૧૦.૨૪ કલાક શુભ મુહૂર્ત છે.

ભાઈબીજ-યમદ્વિતીયા

ગુરુવાર, તા. ૧૫-૧૧-૨૦૧૨ના રોજ ભાઈબીજ મનાવવી.

- મહેશ રાવલ

કાનૂની કાર્યવાહીની ચિમકી : સાધુ-સંતોને ભાગ ન લેવા અપિલ

અમદાવાદના પિરાણાના સંમેલનનો ભારત સાધુ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ

(પ્રતિનિધિ) જૂનાગઢ, તા.૧૩ : અમદાવાદ પાસેના પિરાણામાં સતપંથ સનાતન સંસ્થાન પ્રેરણાપીઠના નેજા હેઠળ સમાજને ભ્રમિત કરીને ઈસ્લામ ધર્મમાં ખેંચી જવા માટે ગેરકાનૂની રીતે હિન્દુઓના ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો ચોંકાવનારો આક્ષેપ ભારત સાધુ સમાજ દ્વારા કરાયો છે. તેમજ આગામી તા.૧૭ ના રોજથી યોજાનારા સંમેલનમાં સાધુ-સંતો અને લોકોને ભાગ ન લેવાની અપિલ સાથે કાનૂની કાર્યવાહી કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

સમાજને ભ્રમમાં નાખી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આક્ષેપ

સતપંથ ધર્મના પ્રચારકો દ્વારા હિન્દુ સંસ્કૃતિના નામ, આચાર અને સાહિત્યનો ઉપયોગ કરીને હિન્દુ પ્રજાને ઈસ્લામ ધર્મ સ્વિકાર કરાવવાની છેતરામણી પ્રવૃત્તિ ચાલી રહી હોવાના આક્ષેપ સાથે ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત ગોપાલાનંદજીએ જણાવ્યું છે કે, આ ભ્રામક પ્રચારથી લોકો જ નહી પણ કેટલાક ભોળા સંતો પણ આ પ્રભાવિત થઈ રહ્યા છે.

આ સંસ્થા દ્વારા હિન્દુ સમાજનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે ઘણી વખત હિન્દુ સંતોના સંમેલનો પણ બોલાવવામાં આવે છે. માટે લોકો એવા ભ્રમમાં આવી જાય છે કે, આ સંસ્થા હિન્દુઓની છે. તા.૧૭ ના રોજથી ત્રણ દિવસ માટે પિરાણામાં સતપંથ દ્વારા આવું જ એક સંમેલન બોલાવવામાં આવી રહ્યું છે. જેમાં મોટા મોટા સંતો ભાગ લે તેવું આયોજન ગોઠવાઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં હિન્દુ ધર્મના કોઈ પણ સંતો કે પ્રજાજનોને ભાગ ન લેવા તેઓએ અપિલ કરી છે. સાથે સાથે આ સંસ્થાના ગાદિપતિ લોકો દ્વારા પોતાના નામની આગળ ગેરકાનૂની રીતે જગતગુરૂની પદવી લગાડવામાં આવે છે. તેની સામે કાનૂની પગલા લેવાની ચિમકી તેમણે અંતમાં ઉચ્ચારી છે.

વેરાવળ નજીક સિંહોના ટોળાએ ત્રણ ગાયોનું મારણ કર્યુ

વેરાવળ : વેરાવળ ગ્રામ્ય પંથકમાં સિંહોના ટોળા કાયમી ફરી રહ્યાં છે. ગઇરાત્રે સુત્રાપાડાના રંગપુર ગામે બે સિંહે જુદી જુદી બે વાડીમાં ઘુસી જઇ બન્ને વાડીઓમાંથી એક એક ગાયનું મારણ કર્યુ હતું. મંડોર ગામે ચાર સિંહે એક વાડીમાંથી એક ગાયનુ મારણ કર્યુ હોવાની વન વિભાગને ફરિયાદ કરવામાં આવી છે.

વાહન હડફેટે ઇજા

વેરાવળ : વેરાવળના ગંગાનગરમાં રહેતા રામ ઇશ્વરશીંગ જમાદારસીંગને વાહન હડફેટે ઇજા થતા સારવાર માટે હોસ્પીટલે ખસેડેલ છે.આ ઉપરાંત સુત્રાપાડા પોલીસે દારૂની ભઠી પકડી પાડી ૧૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝેર પીધેલા યુવાનનું સારવારમાં મોત

જામખંભાળિયા : જામખંભાળિયામાં એસટી ડેપો નજીક વાલ્મિકીવાસમાં રહેતા અજય દીનેશભાઈ વાઘેલા નામના ૩૦ વર્ષીય દલિત યુવાને તા.૧૧મીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને સારવારમાં જામનગર ખસેડવામાં આવ્યો હતો. આ યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.

રિક્ષાની ઠોકરે બાઈક ચાલકને ઈજા

જામખંભાળિયા : તાલુકાના વિંઝલપર ગામે રહેતા લક્ષ્મણ વકુભાઈ છુછર નામનો બાઈક સવાર પસાર થઈ રહયો હતો ત્યારે ધસી આવેલા છકડો રિક્ષા ચાલકે ઠોકર મારતા લક્ષ્મણને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ રિક્ષા ચાલક નાસી છુટયો હતો.

જામખંભાળિયા : ઝેરી દવા પી લેતાં વૃદ્ધ ગંભીર

જામખંભાળિયા : સામોર ગામે રહેતા નારણ વિક્રમભાઈ પીડારિયા નામના ૭૫ વર્ષના વૃદ્ધે ઝેરી દવા ગટવટાવી લેતાં ગંભીર હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

જામનગર, કાલાવડમાં જુગાર અંગે પોલીસના દરોડા

જામનગર : જામનગર અને કાલાવડમાં જુગારના બે દરોડામાં ૧૧ શખ્સોને પોલીસે રૂ. આઠ હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જામનગરમાં સુભાષ પાર્ક શેરી નં. ૫માં જાહેરમાં જુગાર રમી રહેલા વિક્રમ ગુજરીયા, ભરત કોળી, ખુલાસ પ્રવીણ, ભાણજી કોળી, અનીલ શિયાળ સહિત બે સગીરોને રોકડ રૂ.૫૦૩૦ અને મોબાઈલ મળી રૂ. ૬૫૩૦ સાથે પકડી પાડયા હતા. જયારે પરેશ કોળી, જયેશ કોળી, દેવશી કોળી, વિક્રમ અને ઈન્દ્રજીતસિંહ નાસી છુટવામાં સફળ રહ્યા હતા. બીજા દરોડામાં કાલાવડ વાવડીના પાટીયા પાસે જુગાર રમી રહેલા ભુરા સાડમીયા, રાજુ બાબુ નટ અને અમરસિંહ ચૌહાણને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

"નેક" અમ. તા.૧૪/૧૧/૨૦૧૨
ઈંડાના જથ્થા ભાવ રૂા. ૩૩૦/- NECC
છૂટક વેચાણ ભાવ રૂા. ૩૪૦/-
ક્લસ નંગ રૂા. ૭૨/-

સમાચારો ટૂંકાણમાં

અમરેલી : જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા

અમરેલી : મોડી રાતે શાકમારકેટ નજીક જાહેરમા તીનપતીનો જુગાર રમતા અજીઝ ગફાર મેતર, સાજીદ હુશેન પરમાર ,સમીર ઈસ્માઈલ અગવાન, યાસીન અબ્દુલ ઘાંચી સલીમ ઈબ્રાહીમ રાઠોડ સહિતના સાતે રૂ.૮૩૩૦ની રોકડ મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

ઉનાના કંસારી નજીક ત્રિપલ અકસ્માત : ૧૧ ઘવાયા

ઉના : કંસારી ગામ જતા રોડ ઉપર તાલુકાના ભાચા ગામના અશ્વિન રામજીભાઈ કુંભાર તેના પત્ની સંગીતાબેન, ભારતીબેન સામતભાઈ ડાંગોદરા સાથે ઉનાથી ત્રિપલ સવારીમાં દિવાળી સબબ ખરીદી કરી પરત જતા હતા ત્યારે સામે ધોકડવા તરફથી મજુરોને નાથળ મુકવા જતી છકડો રીક્ષા સાથે ધડાકાભેર અથડાતા મોટરસાઈકલ ફંગોળાઈ જતા જઈ રહેલા બીજા બાઈક સાથે અથડાતા તે પણ પડી ગયું હતું.આ ત્રિપલ અકસ્માતથી રોડ ચીસાચીસથી ગાજી ઉઠયો હતો.અકસ્માતમાં દયાબેન કરસનભાઈ, રૂપાબેન કરસનભાઈ, મયુરીબેન જીતુભાઈ સહિત ૧૧ ને ઈજાઓ થતા સારવાર માટે ૧૦૮ મારફત ઉના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જેમાં અશ્વિનાઈ ડાંગોદરા, રૂપાબેન નંદાવાણાની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવેલ છે.

જામનગરમાં અકસ્માતના બે બનાવ : યુવાનનું મોત

જામનગર : જામનગરમાં વાહન અકસ્માતની બે ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યું હતુ. અન્ય ઘટનામાં રિક્ષા પલ્ટી ખાઈ જતા એક મહિલાને ઈજા પહોંચી હતી. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં કેડલ ફીડ કારખાનાના ગોડાઉનમાં કામ કરી રહેલા મજુર બુધેશ્વર રજકસદા નામના યુવાનને ટ્રકના ચાલકે ટ્રક રિવર્સમાં લેતા ટ્રકનું વ્હીલ તેના પર ફરી વળતા ગંભીર ઈજા જતાં મોત થયું હતુ. બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક મુકીને નાસી છૂટયો હતો. જામનગરમાં રણજીતસાગર ગ્રીન સિટી રોડ પર રિક્ષાના ચાલકે બેફીકરાઈથી ચલાવી પલ્ટી ખવડાવી દેતા તેમાં બેસેલા રંભાબેન રવજીભાઈને ઈજા થતાં રિક્ષા ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

ગુડઝ ટ્રેનની હડફેટે ચડી જતાં મોત

અમરેલી : સાવરકુંડલા નજીક ગોરકડા ગામે રહેતા અસ્થિર મગજના વૃદ્ધ બધુભાઈ આપાભાઈ વાળા ઉ.વ.૬૦ ગઈ કાલે ગુડઝ ટ્રેનની હડફેટે ચડી જતાં એનું મોત નીપજયું છે.

પાદરીયામાંથી ૮૭ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામ ખાતે અગાઉથી મળેલી બાતમીના આધારે ગઈકાલે રાત્રે દોઢ વાગ્યે તાલુકા પી.એસ.આઈ. ભાટુ અને સ્ટાફે દરોડો પાડીને નગા સરમણ રબારી નામના શખ્સના ઘરેથી રૂ.૨૬,૧૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૮૭ બોટલ ઝડપી લીધી છે. જો કે નગા રબારી આ દરોડા અગાઉ નાસી છૂટયો છે. જેને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.

મોરાણામાં પ્રાઈમસ ફાટતાં શખ્સનું મોત નિપજયું

જામનગર : જોડીયાના મોરાણા અને ખંભાળિયામાં અપમૃત્યુના બે બનાવ નોંધાયા છે. મોરાણામાં પ્રાયમસ ફાટતા શખ્સનું મોત થયું હતુ. જોડીયા તાલુકાના મોરાણા ગામે પોતાના ઘેર એકલા રહેતા અને રસોઈ બનાવી રહેલા ભગવાનજીભાઈ પ્રેમજીભાઈ સાકરીયા ઓચિંતો પ્રાયમસ ફાટતા આખા શરીરે દાઝી ગયા હતા. તાકીદે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત પામેલા જાહેર કર્યા હતા. ખંભાળિયા બસ સ્ટેન્ડ પાસે રહેતા અજય દિનેશભાઈ વાઘેલા નામનો યુવાન પોતાના ઘરે ભુલથી ઉધરસના બદલે ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મોત થયું હતુ.

ચારણ સમઢીયાળામાં ગૌશાળાના લાભાર્થે લોકડાયરો યોજાશે

ચારણ સમઢીયાળા : જેતપુર તાલુકાના ચારણસમઢીયાળામાં ગૌશાળાના લાભાર્થે તા.૧૬ ને શુક્રવારે રાત્રે ૯ કલાકે ગામ સમસ્તના સહકારથી લોકડાયરાનું આયોજન કરાયું છે.જેમાં કલાકારો માયાભાઈ આહિર, હરેશદાન ગઢવી, મનહરદાન ગઢવી, મીનાબેન જાડેજા, શ્રુતિબેન આહિર, વૃષભભાઈ આહિર પોતાની કલાનો લાભ આપશે. ધર્મપ્રેમીજનોને લાભ લેવા જણાવાયું છે.

પાકિસ્તાનથી મુકત થયેલા

૧૫ ભારતીય માછીમારો કાલે વેરાવળથી વતન રવાના થશે

વેરાવળ તા.૧૩

પાકિસ્તાનની જેલમાં સબડતા ૧૫ માછીમારો મુક્ત થતા વાઘા બોર્ડરથી આવતીકાલે વેરાવળ ખાતે ફિશરીઝ કચેરીએ આવી પહોચશે જ્યાં પરિવાર સાથે તેમનું મિલન થતા અશ્રુભીના દ્રશ્યો સર્જાશે. આ માછીમારોમાં સાત દિવ, બે પોરબંદર, પાંચ ઉના અને એક વેરાવળનો સમાવેશ થાય છે.

સાત દિવ, પાંચ ઉના, બે પોરબંદર, એક વેરાવળના માછીમારનો સમાવેશ

વેરાવળ ફિશરીઝ અધિકારી શુકલા, રાડા તેમજ ગઢિયાભાઈ દ્વારા અપાયેલી માહિતી મુજબ પાકિસ્તાન જેલમાં છેલ્લા સાત માસથી સબડતા પંદર માછીમારોને તા.૧૨ના રોજ મુક્ત થતા વાઘા બોર્ડરથી માદરે વતન જવા રવાના થયા હતા જે તા.૧૫ને ગુરૂવારના રોજ વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે આવી પહોચશે. આ માછીમારોમાં દિવના અમૃત જીવા બામણીયા. બાબુ ભીખા બામણીયા. જીવન કરશન બામણીયા, વિજય લખમણ સોલંકી, જીતેન્દ્ર દિલીપ વૈશ્ય, પ્રેમજી રામજી જેઠવા અને ભીખા વરજાંગ બામણીયા, પોરબંદરના લાખા દેવા ભાલીયા, પ્રકાશ સોમા સોલંકી, ઉનાના તડના કાળુ ગોવિંદ વાજા, મનસુખ ઉકા સોલંકી, કારુ રામ વાળા, ઉનાના કાજરડીના સંજય જીવા ચારણીયા, પાલડીના દેવસી મસરી સોલંકી કાજરડીના સંજય જીવા ચારણીયા, વેરાવળના ચુનીલાલ કરશન બામણીયાનો સમાવેશ થાય છે. આવતીકાલે ફીશરીઝ કચેરીથી માદરે વતન જવા રવાના થશે.

મૃત્યુનોંધ

જૂનાગઢ સ્ત્રી નિકેતન વાળા પદ્માબેન શાસ્ત્રીના બહેનનું અવસાન

જૂનાગઢ : બિલખા નિવાસી હાલ મુંબઈ જયેન્દ્રબાળા મહેતા(ઉ.વ.૭૫) તે જવાહરભાઈ એમ. મહેતાના પત્ની તથા સ્વ.ગિરધરલાલ જે. વ્યાસના પુત્રી તેમજ પદ્માબેન બી. શાસ્ત્રી, દિનુભાઈ વ્યાસ અને નટુભાઈના બહેન તથા પ્રકાશ, નયના, મિહિર અને માલિનીના માતુશ્રી તેમજ પાયલ, સાર્થક, જય અને વિરેનના દાદી તેમજ મનન, નિરાલી અને માનસીના નાની તથા નિપા, હિના, ધનરાજ અને મહેશના સાસુનું તા.૧૨ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે બિલનાથ મંદિર, એગ્રી કેમ્પસ રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

જામનગર : મૂળ શેખપાટ નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ જેન્તીલાલ પ્રાણશંકર પંડયાના પત્ની પ્રફુલાબહેન (ઉ.વ. ૬૧) તે અશોકભાઈ, રમેશભાઈ, કિર્તીભાઈ, તથા પ્રફુલાભાઈ પંડયાના ભાભી તેમજ પ્રિતીબહેન એન. યાજ્ઞિક, પૂજાબહેન આર.આચાર્ય, અને નહેલબહેન એસ દવેના માતા તથા રાજુ ત્રિવેદીના બહેનનું તા. ૧૨ના અવસાન થયું છે. ઉઠમણું તા. ૧૬ના સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન શ્રીનગર સોસાયટી, રાજ ચેમ્બર પાછળ, એરોડ્રામ રોડ, જામનગર ખાતે રાખ્યું છે.

જૂનાગઢ : ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ દિવાળીબેન પંડયા (દયાબેન) (ઉ.વ. ૮૨) તે સ્વ. ધીરજલાલ ભગવાનજી પંડયાના પત્ની તથા સ્વ. જયશંકર ત્રિ. વ્યાસના પુત્રી, અભય ડી. પંડયા, કાર્તિદાબેન જોષી, નયનાબેન રાવલ, દર્શનાબેન શુકલના માતા તથા કિશોરકુમાર જોષી, યદુવંદન રાવલ, શૈલેશભાઈ શુકલના સાસુ, આલાપ તથા આયુષીના દાદીમાં તા. ૧૨ ના રોજ સ્વર્ગવાસી થયા છે. ઉઠમણું તા. ૧૫ ને ગુરૂવારે ૪ થી ૫-૩૦ દરમિયાન ગિરીરાજ સોસાયટી નં. ૨ રામેશ્વર મંદિર મધ્યે રાખેલ છે.

રાજકોટ : સોની રાણપરા નિર્મળાબેન (ઉ.વ. ૯૦) તે સ્વ. નરભેરામભાઈના પત્ની, લાલુભાઈ મીનાવાળા, શશીભાઈ, કમલેશભાઈ, ગોપાલ ભાઈના ભાભુ તથા હસમુખ, જીતેન્દ્ર, સુર્યપ્રકાશના મોટા દાદીનું તા. ૧૨ ના અવસાન થયું છે. બેસણું તા. ૧૫ ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ દરમિયાન બોલબાલા મંદિર, ૯, લક્ષ્મીવાડી ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

જૂનાગઢ : વરીયા વૈષ્ણવ પ્રજાપતિ સચાણીયા ગોવિંદભાઈ તેજાભાઈ (ઉ.વ. ૭૨) તે ભરતભાઈના પિતા તથા ભીખુભાઈ વસવેલીયા (જી.ઈ.બી.) સ્વ. રમેશભાઈ, રવજીભાઈ નળિયાપરા (જેતપુર) દિલીપભાઈ લવજીભાઈ (થાન), આશિષભાઈ રવજીભાઈ નાં સસરાનું તા. ૧૩ ના અવસાન થયું છે. બેસણું તા. ૧૬ ને શુક્રવારનાં સાંજે ૪ થી ૬ આઈ.એસ.એ. હોલ, પોસ્ટ ઓફિસ સામે, ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

૧૦૫ વર્ષના હરીબેન જાદવનું અવસાન

વાંકાનેર : ગં.સ્વ. હરીબેન માનસીંગભાઈ જાદવ (ઉ.વ. ૧૦૫) તે કેશુભાઈ ભવાનભાઈ વાઘેલા (રાજકોટ) ના સાસુ, અનીલભાઈ હરીભાઈ પરમાર (મોરબી સેન્ટ્રલ બેંક) નરેન્દ્રભાઈ, યોગેશભાઈ, મહેન્દ્રભાઈ, પ્રતાપભાઈ, મોહનભાઈ પરમાર (એસ.બી.આઈ) તથા ખોડુભાઈ રામજીભાઈ પરમારના ફૈબાનું તા. ૧૩ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૫ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ અનિલભાઈ એસ. પરમારને ત્યાં ગોડાઉન રોડ વિશીપરા "શ્રધ્ધા" વાંકાનેર ખાતે રાખેલ છે.

ઉના : નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ મુળ આમોદરા નિવાસી હાલ ઉનાના હરીશંકર નારણજીભાઈ ઠાકર (ઉ.વ.૭૭) તે સ્વ. જેન્તીલાલ ના નાનાભાઈ તથા અનંતરાય, પ્રવીણભાઈ, સંજયભાઈનાં પિતા તથા કનુભાઈ, જીતેન્દ્રભાઈ (પત્રકાર અમોદરા) ના કાકા તા. ૧૨ નાં કૈલાસ વાસી થયા છે. ઉઠમણું તા. ૧૫ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુર્યમુખી હનુમાન મંદિર ગીરગઢડા રોડ ઉના ખાતે રાખેલ છે.

મોરબી : લુહાર ગોવિંદભાઈ રવજીભાઈ મારૂ (ઉ.વ. ૭૮) તે અશોકભાઈ, દીપકભાઈ, સંજયભાઈ નાં પિતા તથા મકવાણા કાનજીભાઈ પંચાણભાઈ (ધુનડા (શ) વાળા) ના જમાઈનું તા. ૧૨ ના અવસાન થયું છે. બેસણું તા. ૧૫ ને ગુરૂવારે સાંજે ૪ થી ૫.૩૦ દરમિયાન જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે. સસરા પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

વાંકાનેર : મોરબીવાળા મોહનલાલ વલ્લભદાસ મદીયારના પુત્ર ધીરજલાલ (ઉ.વ.૮૦)તે રાજેશ ડી. મણીયારના પિતા તથા આર.એમ. મણીયાર (મોરબી)ના વડીલબંધુનું અવસાન થયું છે. બેસણું તા. ૧૫ના ગુરૂવારે વાંકાનેર ખાતે પેડક વિસ્તારમાં મેઈન રોડ પર તેમના નિવાસસ્થાને સાંજે ૪ થી ૫ રાખેલ છે. તથા તા. ૧૩ને શુક્રવારે મોરબી ખાતે મોઢ વાણીયા જ્ઞાતિની વાડીમાં સાંજે ૪ થી ૫ દરમિયાન રાખેલ છે.

વાંકાનેર : જયંતીલાલ રવિચંદ શેઠ (વિકાસ)ના પત્ની તથા છગનલાલ લીલાધર દોશીના પુત્રી વિજયાબેન મહેતા, દીપાબેન કૌશિક શાહ, ભાવનાબેન મીતેશ ગાંધી તથા હિતેશભાઈના માતા તા. ૧૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૫ના ગુરૂવારે ૧૦.૩૦ વાગ્યે વિશા શ્રીમાળી સ્થાનકવી જૈન ભોજન શાળા દિવાનપરા વાંકાનેર ખાતે રાખેલ છે.

ઉના : નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ મૂળ આમોદ્રા હાલ ઉના નિવાસી ઠાકર મણીશંકર નારણજી (ઉ.વ.૭૭)તે સ્વ. પ્રવિણભાઈ ઠાકર (ઉના પીપલ્સ બેન્ક)ના પિતા તેમજ કનુભાઈ ઠાકર, જીતેન્દ્રભાઈ ઠાકર પત્રકાર આમોદ્રાના કાકા તા. ૧૨ને સોમવારના રોજ કૈલાસવાસી થયેલ છે. સ્વ.નું ઉઠમણું તા. ૧૫ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ સૂર્યમૂખી હનુમાન મંદિર ઉના ખાતે રાખેલ છે.

જૂનાગઢ : નથળીયા ઉનેવાળ બ્રાહ્મણ જયાબેન વસંતરાય મહેતા (ઉ.વ. ૮૨) તે વસંતરાય ગોવિંદજી મહેતાના પત્ની તેમજ દીપકભાઈ મહેતા (નાયબ મેનેજર પુરવઠા નિગમ જામનગર) લલીતભાઈ (એડવોકેટ) યોગેશભાઈ તથા રોહીણીબેન હિતેશ કુમાર જોષી(અમરેલી) ના માતા તા. ૧૨ ના અક્ષરવાસી થયા છે. પ્રાર્થનાસભા તા. ૧૬ ને શુક્રવારે બપોરે ૨ થી ૫ નાથળીયા ઉનેવાળ બ્રહ્મ સમાજવાડી, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

રાજકોટ : મુળ વતન રોજકા હાલ રાજકોટ ના ટેમુભા નાયુબ ચુડાસમા તે જયુભા, જિતેન્દ્રસિંહના પિતા ગિરીરાજસિંહ, શકિતસિંહ, હરપાલસિંહ અને યુવરાજસિંહના દાદાબાપુનું તા. ૧૨ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૬ ને શુક્રવારે ૪ થી ૬ દરમિયાન તેમના નિવાસ "આઈ શ્રી ખોડિયારમાં બાલાજી પાર્ક, શેરી નં. ૪, કોઠારીયા મેઈન રોડ, શણગાર હોલની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ : અયોધ્યા નિવાસી હાલ રાજકોટના મંગળદાસ ભીખુભાઈ શાહ(ઉ.૮૨) તે રાજેશભાઈ, અનિલભાઈ અને જયેશભાઈના પિતા તા.૧૨ ના રોજ અવસાન પામ્યા છે.બેસણું તા.૧૫ ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમિયાન, શ્રીરામ કુટિર, મારૂતિનગર-૧, એરપોર્ટ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

અમરેલી : દિવાળીબેન મુળજીભાઈ કાનપરીયા (ઉ.વ. ૮૭) (વિઠ્ઠલભાઈ ખંભાળયાવાળા) તે ધીરૂભાઈ એમ. કાનપરીયા (રીટાયર્ડ આઈ.ટી. ઈન્સપેકટર) ના માતા તા. ૧૨ ના અવસાન થયું છે.

ધારી : ગોવિંદપુર નિવાસી રાજગોર બ્રાહ્મણ મહેતા ઘનશ્યામભાઈ કેશવજીભાઈ (ઉ.૬૮) તે ખોડૂભાઈ,સુર્યકાંતભાઈ(પ્રા.શિક્ષક)ના પિતા અને પ્રતિક, પાર્થ ભાવેશભાઈ, નિકુંજના દાદાનું તા.૧૦ ના રોજ અવસાન થયું છે.

જામનગર : કેરાલી(તા.જોડીયા) નિવાસી ગગુબા અનુભા જાડેજા(ઉ.૮૭) તે બળવંતસિંહ (નિવૃત પીએસઆઈ), રણજીતસિંહ(પીઆઈ ઉપલેટા)ના માતા તથા વિજયસિંહ(એસપી કચેરી જામનગર),જયેન્દ્રસિંહ(પીપાવાવ શીપ યાર્ડ)ના દાદીમાનું તા.૧૧ના રોજ અવસાન થયું છે.બેસણું તા.૧૭ ને શનિવારે ૪ થી ૫ દરમિયાન,કેરાલી ખાતે રાખેલ છે.

જેતપુર : જેતપુર નિવાસી મણીબેન મોહનભાઈ મોણપરા (ઉ.વ. ૯૦) તે મોહનભાઈ ઉકાભાઈના પત્ની તથા પરસોતમભાઈ અને પ્રાગજીભાઈ ના માતા તેમજ કપિલના દાદીમાંનું તા. ૧૩ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૬ ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ધોરાજી રોડ પંચવટી સોસાયટીની બાજુમાં શિવનગર - જેતપુર ખાતે રાખેલ છે.

બગસરા : ભલગામ (મોટા) નિવાસી સ્વ. ઠકકર નંદલાલ ત્રિકમજીભાઈ ડોળાશીયાના પત્ની જયાબેન (ઉ.વ.૮૦) તે મોરભાઈનાં ભાભી તેમજ પ્રફુલભાઈ, રાજુભાઈ, દીપકભાઈના માતાનું તા.૧૩નાં સુરત મુકામે અવસાન થયેલ છે. બેસણું તા.૧૭ શનિવાર સાંજના ૪ થી ૬ જલારામ અન્નક્ષેત્ર લાભેશ્વર પોલીસ ચોકી પાસે માતાવાડી વરાચ્છા સુરત ખાતે રાખેલ છે.

સંદેશ news

GTPL, Den પર પણ ઉપલબ્ધ
સેટટોપ બોક્સ માટે ચેનલ નંબર આ મુજબ છે
GTPL Digital 268/ Analog- S-3,
DEN NET Digital 80/ Analog- off/ Analog U-51

આજે સંદેશ ન્યૂઝ પર નિહાળો

સવારના ૬.૩૦થી ૯ કલાકે

સમય	પ્રોગ્રામ
૦૬:૩૦	ગુરુવચન
૦૭:૦૦	ન્યૂઝ @ 7 am
૦૭:૩૦	આજનો મહિમા
૦૮:૦૦	સુપ્રભાત ગુજરાત
૦૮:૩૦	બિઝનેસ સંદેશ

સવારના ૯ થી ૧૨ કલાકે

સમય	પ્રોગ્રામ
૦૯:૦૦	ન્યૂઝ એક્સપ્રેસ
૦૯:૩૦	લાઇટ્સ કેમેરા એક્શન
૧૦:૦૦	ન્યૂઝ @ 10 am
૧૦:૩૦	સ્પેશિયલ રિપોર્ટ
૧૧:૦૦	ન્યૂઝ @ 11 am
૧૧:૩૦	સિટી લાઇફ

બપોરે ૧૨ થી ૩ કલાકે

સમય	પ્રોગ્રામ
૧૨:૦૦	ન્યૂઝ @ 12
૧૨:૩૦	ખબર ગુજરાત
૧:૦૦	ન્યૂઝ @ 1 pm
૧:૩૦	ખાના-ખજાના
૨:૦૦	ન્યૂઝ @ 2 pm
૨:૩૦	ક્રાઇમ એલર્ટ

બપોરે ૩ થી ૬ કલાકે

સમય	પ્રોગ્રામ
૩:૦૦	ન્યૂઝ અપડેટ
૩:૧૫	વુમન સ્પેશિયલ
૩:૩૫	ધ હેલ્થ શો
૫:૩૦	બિઝનેસ સંદેશ

સાંજે ૬ થી ૯ કલાકે

સમય	પ્રોગ્રામ
૬:૦૦	સિટી લાઇફ
૬:૩૦	સ્પોર્ટ્સ
૭:૦૦	ન્યૂઝ એક્સપ્રેસ
૭:૩૦	ખબર ગુજરાત
૮:૦૦	ન્યૂઝ @ 8 pm
૮:૩૦	મેટ્રો ન્યૂઝ

રાત્રે ૯ થી ૧૨ કલાકે

સમય	પ્રોગ્રામ
૯:૦૦	એક્સ્ટ્રા કોમેન્ટ
૯:૩૦	એક્સ્ટ્રા કોમેન્ટ
૧૦:૦૦	ન્યૂઝ @ 10
૧૦:૩૦	સ્પેશિયલ રિપોર્ટ
૧૧:૦૦	લાઇટ્સ કેમેરા એક્શન
૧૧:૩૦	ક્રાઇમ એલર્ટ
૧૨:૦૦	ન્યૂઝ @ 12 am

જોવાનું ચૂકશો નહીં

- પ્રસિદ્ધ જ્યોતિષ બેજાન દારૂવાલા જણાવશે તમારૂ આગામી વર્ષ કેવું રહેશે.

જુઓ આજે સંદેશ ન્યૂઝમાં સાંજે ૪ થી ૫

સેમિનાર, સભા, સમારંભ જેવા કાર્યક્રમોની માહિતી ચેનલ પરથી પ્રસારિત કરવા નીચેના સરનામે પ્રેસનોટ, ફોટોગ્રાફ્સ, આમંત્રણ પત્રિકા, માહિતી વગેરે મોકલવા વિનંતી

સંદેશ ટેલિકાસ્ટ, સંદેશ ભવન, લાડ સોસાયટી રોડ, પો.ઓ.બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪, ટેલિફોન નંબર- ૦૭૯ ૪૦૦૦ ૪૦૦૦, ફેક્સ નંબર-૦૭૯ ૪૦૦૦ ૪૨૦૫, ઇ-મેઇલ આઇ.ડી. info@sandeshnews.tv

ફટાકડાના સ્ટોલના પૈસા બાબતની માથાકૂટમાં

જામનગરમાં ચાર શખ્સોને દૂકાનદારને ઢીબી નાખ્યો

મારી નાખવાની ધમકી આપ્યાની પણ ફરિયાદ

જામનગર,તા,૧૨ : જામનગરની ખોડીયાર કોલોનીમાં ફટાકડાના સ્ટોલના પૈસા બાબતે ચાર શખ્સોએ દૂકાનદારને ઢીબી નાખતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ખોડીયાર કોલોનીમાં ફટાકડાનો સ્ટોલ નાખીને બેસેલા જયસુખ મુળજીભાઈ ચૌહાણના સ્ટોલમાં ફટાકડા લેવા પૃથ્વીસિંહ, ધર્મેન્દ્રસિંહ ભૂપતસિંહ, દીગુભા પ્રતાપસિંહ, જયપાલ જાડો નામના શખ્સો ગયા હતા. ફટાકડા લઇ હિસાબ કરતી વખતે માથાકુટ થતાં ચારેય શખ્સોએ ઢીકાપાટુનો માર મારી પોલીસને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ચાલ્યા જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરમાં વિરલબાગ પાસે

બૂટલેગર અને પોલીસ વચ્ચે ઝપાઝપી, પીએસઆઈને ઈજા

કાર લઈ બૂટલેગર નાસી જતાં ફરિયાદ નોંધાવાઇ

જામનગર : વિરલબાગ પાસે કારમાં કથિત રીતે દારૂ લઈને નિકળેલા શખ્સને પીએસઆઈએ આંતરી તપાસણી કરવાનું કહેતા ગરાસીયા શખ્સે ઝપાઝપી કરી ગાડી સાથે નાશી છુટતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિરલબાગ આગળ દાદા દાદી ગાર્ડન પાછળ ખાંચામાં પેટ્રોલિંગમાં રહેલા પીએસઆઈ ગીરીશ વાઘેલાને શંકા જતાં ઈન્ડીકા વિસ્ટા કારમાં રહેલા દિગુભા જાડેજાને કાર ચેક કરવાનું કહેતા દિગુભાએ 'તુ દારૂનો ધંધો કરવા દેતો નથી, આજે તને મારી નાખવો છે' તેમ કહી ફરજમાં રૂકાવટ કરી પીએસઆઈ સાથે ઝપાઝપી કરી કાર સાથે ઢસડી આંગળીઓમાં ઈજા કરી નાસી છૂટતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગર-મીઠાપુરમાં બે સ્થળે તસ્કરોનો હાથફેરો

જામનગર : મીઠાપુરમાં ચોરીના બે બનાવમાં ચોરીના બે બનાવમાં તસ્કરોને રૂ. એક લાખ છ હજારનો ધનલાભ થયો હતો. જામનગરમાં નેશનલ પાર્કમાં રહેતા ઈમરાન સતારભાઈ પોપટપોત્રાના ઘરના તાળા તોડી કોઈ ઈસમ સોનાના પાટલા આશરે રૂ. એક લાખની કિંમતના સાડા ત્રણ તોલાના ચોરી જતાં પોલીસમાં ફરિયાદ થઈ છે. મીઠાપુર ટાટા કંપની ટાઉનશીપ વિસ્તારમાં કોઈ શખ્સ બુસ્ટર કંપની સાથે લાગેલા એલ્યુમિનિયમના કાળા કલરના રૂ. છ હજારની કિંમતના વાયર ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ થઈ છે.

https://archive.org/details/bk1387/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

Real Patidar
Unravel Truth

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk1387/page/n2/mode/1up

2012-11-14 -Bharat Sadhu Samaj Virodh -Pirana Sammelan -Sandesh (1387)

realpatidar.com

ધોકા, છરી, ધારીયા, તલવાર વડે તૂટી પડ્યા

મોરબીમાં જુની દુશ્મનાવટમાં યુવાન ઉપર જીવલેણ હુમલો

(સંદેશ બ્યુરો) મોરબી તા. ૧૩ મોરબીના મકરાણી વાસમાં રહેતા ઠાકોર યુવાન પર કાળી ચૌદશની રાત્રે જુના વેરઝેરનો ખાર રાખી ચાર શખ્સોએ ધોકા, છરી, ધારીયા, તલવાર જેવા ઘાતક શસ્ત્રોથી જીવલેણ હુમલો કરી રામચોક નજીક ગાડીમાંથી ફેકીને નાસી છુટયા બાદ બેશુધ્ધ થયેલા ઠાકોર યુવાનને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો છે.

ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

પોલીસે ઈજાગ્રસ્ત યુવાનની ફરીયાદ પરથી ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો છે.

મોરબીના નાની બજારમાં આવેલા ખત્રીવાડ અને મકરાણી વાસમાં રહેતા અમીત જયંતીભાઈ ઠાકોર નામના યુવાન પર ગઈરાત્રે કાલીકાપ્લોટ વિસ્તારમાં રહેતા હનીફ ગુલામમીર, અસલમ સલીમ સંધી, ઈસ્માઈલ આદમ ખેરાજી અને મુસ્તાક ગુલામમીરે અમીતે અગાઉના જુના વેરઝેરનો ખાર રાખી ઉપરોકત ચારેય શખ્સો છરી, તલવાર, ધારીયું અને ધોકા જેવા હથીયારોથી ઠાકોર યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવાન બેશુધ્ધ થઈ જતા ચારેય શખ્સો ગાડીમાં બેસાડીને બેશુધ્ધ હાલતમાં રામચોક વિસ્તારમાં ફેકીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ગંભીર ઈજા પામેલા ઠાકોર યુવાનને બેશુધ્ધ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો. પોલીસે તેની ફરીયાદ નોંધીને ચારેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્નકૂટ : નૂતનવર્ષની પૂર્વ સંધ્યાએ છારોડી ગુરૂકુળમાં ૧૦૮ પ્રકારની વાનગીઓનો અન્નકૂટ ઠાકોરજીને ધરવામાં આવ્યો હતો. માધવપ્રિયદાસજી અને પુરાણી બાલકૃષ્ણદાસજીએ આરતી ઉતારી દર્શન ખૂલ્લા મુકયા હતા. અન્નકૂટનો પ્રસાદ હોસ્પિટલ અને ગરીબોને વહેંચવામાં આવશે.

નૂતન વર્ષ ૨૦૬૯ના શુભ મુહૂર્તો

આજે બુધવાર, તા. ૧૪ નવેમ્બરે વિક્રમ સંવત ૨૦૬૯નો પ્રારંભ થશે. બેસતું વર્ષ છે. ગોવર્ધનપૂજા- અન્નકૂટ માટે ઉત્તમ દિવસ છે. અમૃતસિદ્ધિ યોગ બપોરે ૧૨.૧૪ કલાકથી શરૂ થતાં શુભ કાર્ય પ્રારંભ માટે ઉત્તમ મુહૂર્ત છે. મિતિ નાખવી. ઉદ્‌ઘાટન, વેપાર પ્રારંભ અને શુભ કાર્ય પ્રસંગ માટે સવારે ૭.૦૦ કલાકથી ૮.૨૦ કલાકનો સમય શ્રેષ્ઠ છે. ૮.૨૪ ક.થી ૯.૫૪ કલાક પણ શુભ સમય છે. સવારે ૧૧.૨૪ કલાકથી ૧.૫૪ કલાક પણ શુભ સમય મળે છે. સાંજે ૭.૨૪ કલાકથી ૧૦.૨૪ કલાક શુભ મુહૂર્ત છે.

ભાઈબીજ-યમદ્વિતીયા

ગુરુવાર, તા. ૧૫-૧૧-૨૦૧૨ના રોજ ભાઈબીજ મનાવવી.

- મહેશ રાવલ

કાનૂની કાર્યવાહીની ચિમકી : સાધુ-સંતોને ભાગ ન લેવા અપિલ

અમદાવાદના પિરાણાના સંમેલનનો ભારત સાધુ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ

(પ્રતિનિધિ) જૂનાગઢ, તા.૧૩ : અમદાવાદ પાસેના પિરાણામાં સતપંથ સનાતન સંસ્થાન પ્રેરણાપીઠના નેજા હેઠળ સમાજને ભ્રમિત કરીને ઈસ્લામ ધર્મમાં ખેંચી જવા માટે ગેરકાનૂની રીતે હિન્દુઓના ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો ચોંકાવનારો આક્ષેપ ભારત સાધુ સમાજ દ્વારા કરાયો છે. તેમજ આગામી તા.૧૭ ના રોજથી યોજાનારા સંમેલનમાં સાધુ-સંતો અને લોકોને ભાગ ન લેવાની અપિલ સાથે કાનૂની કાર્યવાહી કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

સમાજને ભ્રમમાં નાખી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનો આક્ષેપ

સતપંથ ધર્મના પ્રચારકો દ્વારા હિન્દુ સંસ્કૃતિના નામ, આચાર અને સાહિત્યનો ઉપયોગ કરીને હિન્દુ પ્રજાને ઈસ્લામ ધર્મ સ્વિકાર કરાવવાની છેતરામણી પ્રવૃત્તિ ચાલી રહી હોવાના આક્ષેપ સાથે ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત ગોપાલાનંદજીએ જણાવ્યું છે કે, આ ભ્રામક પ્રચારથી લોકો જ નહી પણ કેટલાક ભોળા સંતો પણ આ પ્રભાવિત થઈ રહ્યા છે.

આ સંસ્થા દ્વારા હિન્દુ સમાજનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે ઘણી વખત હિન્દુ સંતોના સંમેલનો પણ બોલાવવામાં આવે છે. માટે લોકો એવા ભ્રમમાં આવી જાય છે કે, આ સંસ્થા હિન્દુઓની છે. તા.૧૭ ના રોજથી ત્રણ દિવસ માટે પિરાણામાં સતપંથ દ્વારા આવું જ એક સંમેલન બોલાવવામાં આવી રહ્યું છે. જેમાં મોટા મોટા સંતો ભાગ લે તેવું આયોજન ગોઠવાઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં હિન્દુ ધર્મના કોઈ પણ સંતો કે પ્રજાજનોને ભાગ ન લેવા તેઓએ અપિલ કરી છે. સાથે સાથે આ સંસ્થાના ગાદિપતિ લોકો દ્વારા પોતાના નામની આગળ ગેરકાનૂની રીતે જગતગુરૂની પદવી લગાડવામાં આવે છે. તેની સામે કાનૂની પગલા લેવાની ચિમકી તેમણે અંતમાં ઉચ્ચારી છે.

વેરાવળ નજીક સિંહોના ટોળાએ ત્રણ ગાયોનું મારણ કર્યુ

વેરાવળ : વેરાવળ ગ્રામ્ય પંથકમાં સિંહોના ટોળા કાયમી ફરી રહ્યાં છે. ગઇરાત્રે સુત્રાપાડાના રંગપુર ગામે બે સિંહે જુદી જુ બે વાડીમાં ઘુસી જઇ બન્ને વાડીઓમાંથી એક એક ગાયનું મારણ કર્યુ હતું. મંડોર ગામે ચાર સિંહે એક વાડીમાંથી એક ગાયનુ મારણ કર્યુ હોવાની વન વિભાગને ફરિયાદ કરવામાં આવી છે.

વાહન હડફેટે ઇજા

વેરાવળ : વેરાવળના ગંગાનગરમાં રહેતા રામ ઇશ્વરશીંગ જમાદારસીંગને વાહન હડફેટે ઇજા થતા સારવાર માટે હોસ્પીટલે ખસેડેલ છે.આ ઉપરાંત સુત્રાપાડા પોલીસે દારૂની ભઠી પકડી પાડી ૧૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝેર પીધેલા યુવાનનું સારવારમાં મોત

જામખંભાળિયા : જામખંભાળિયામાં એસટી ડેપો નજીક વાલ્મિકીવાસમાં રહેતા અજય દીનેશભાઈ વાઘેલા નામના ૩૦ વર્ષીય દલિત યુવાને તા.૧૧મીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને સારવારમાં જામનગર ખસેડવામાં આવ્યો હતો. આ યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.

રિક્ષાની ઠોકરે બાઈક ચાલકને ઈજા

જામખંભાળિયા : તાલુકાના વિંઝલપર ગામે રહેતા લક્ષ્મણ વકુભાઈ છુછર નામનો બાઈક સવાર પસાર થઈ રહયો હતો ત્યારે ધસી આવેલા છકડો રિક્ષા ચાલકે ઠોકર મારતા લક્ષ્મણને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ રિક્ષા ચાલક નાસી છુટયો હતો.

જામખંભાળિયા : ઝેરી દવા પી લેતાં વૃદ્ધ ગંભીર

જામખંભાળિયા : સામોર ગામે રહેતા નારણ વિક્રમભાઈ પીડારિયા નામના ૭૫ વર્ષના વૃદ્ધે ઝેરી દવા ગટવટાવી લેતાં ગંભીર હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

જામનગર, કાલાવડમાં જુગાર અંગે પોલીસના દરોડા

જામનગર : જામનગર અને કાલાવડમાં જુગારના બે દરોડામાં ૧૧ શખ્સોને પોલીસે રૂ. આઠ હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જામનગરમાં સુભાષ પાર્ક શેરી નં. ૫માં જાહેરમાં જુગાર રમી રહેલા વિક્રમ ગુજરીયા, ભરત કોળી, ખુલાસ પ્રવીણ, ભાણજી કોળી, અનીલ શિયાળ સહિત બે સગીરોને રોકડ રૂ.૫૦૩૦ અને મોબાઈલ મળી રૂ. ૬૫૩૦ સાથે પકડી પાડયા હતા. જ્યારે પરેશ કોળી, જયેશ કોળી, દેવશી કોળી, વિક્રમ અને ઈન્દ્રજીતસિંહ નાસી છુટવામાં સફળ રહ્યા હતા. બીજા દરોડામાં કાલાવડ વાવડીના પાટીયા પાસે જુગાર રમી રહેલા ભુરા સાડમીયા, રાજુ બાબુ નટ અને અમરસિંહ ચૌહાણને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

"નેક" અમ. તા.૧૪/૧૧/૨૦૧૨
ઈંડાના જથ્થા ભાવ રૂા. ૩૩૦/- NECC
છૂટક વેચાણ ભાવ રૂા. ૩૪૦/-
કલ્સ નંગ રૂા. ૭૨/-

સમાચારો ટૂંકાણમાં

અમરેલી : જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા

અમરેલી : મોડી રાતે શાકમારકેટ નજીક જાહેરમા તીનપતીનો જુગાર રમતા અજીઝ ગફાર મેતર, સાજીદ હુશેન પરમાર ,સમીર ઈસ્માઈલ અગવાન, યાસીન અબ્દુલ ઘાંચી સલીમ ઈબ્રાહીમ રાઠોડ સહિતના સાતે રૂ.૮૩૩૦ની રોકડ મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

ઉનાના કંસારી નજીક ત્રિપલ અકસ્માત : ૧૧ ઘવાયા

ઉના : કંસારી ગામ જતા રોડ ઉપર તાલુકાના ભાચા ગામના અશ્વિન રામજીભાઈ કુંભાર તેના પત્ની સંગીતાબેન, ભારતીબેન સામતભાઈ ડાંગોદરા સાથે ઉનાથી ત્રિપલ સવારીમાં દિવાળી સબબ ખરીદી કરી પરત જતા હતા ત્યારે સામે ધોકડવા તરફથી મજુરોને નાથળ મુકવા જતી છકડો રીક્ષા સાથે ધડાકાભેર અથડાતા મોટરસાઈકલ ફંગોળાઈ જતા જઈ રહેલા બીજા બાઈક સાથે અથડાતા તે પણ પડી ગયું હતું.આ ત્રિપલ અકસ્માતથી રોડ ચીસાચીસથી ગાજી ઉઠયો હતો.અકસ્માતમાં દયાબેન કરસનભાઈ, રૂપાબેન કરસનભાઈ, મયુરીબેન જીતુભાઈ સહિત ૧૧ ને ઈજાઓ થતા સારવાર માટે ૧૦૮ મારફત ઉના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જેમાં અશ્વિનાઈ ડાંગોદરા, રૂપાબેન નંદાવાણાની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવેલ છે.

જામનગરમાં અકસ્માતના બે બનાવ : યુવાનનું મોત

જામનગર : જામનગરમાં વાહન અકસ્માતની બે ઘટનામાં એક યુવકનું મોત નિપજયું હતુ. અન્ય ઘટનામાં રિક્ષા પલ્ટી ખાઈ જતા એક મહિલાને ઈજા પહોંચી હતી. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં કેડલ ફીડ કારખાનાના ગોડાઉનમાં કામ કરી રહેલા મજુર બુધેશ્વર રજકસદા નામના યુવાનને ટ્રકના ચાલકે ટ્રક રિવર્સમાં લેતા ટ્રકનું વ્હીલ તેના પર ફરી વળતા ગંભીર ઈજા જતાં મોત થયું હતુ. બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક મુકીને નાસી છૂટયો હતો. જામનગરમાં રણજીતસાગર ગ્રીન સિટી રોડ પર રિક્ષાના ચાલકે બેફીકરાઈથી ચલાવી પલ્ટી ખવડાવી દેતા તેમાં બેસેલા રંભાબેન રવજીભાઈને ઈજા થતાં રિક્ષા ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

ગુડઝ ટ્રેનની હડફેટે ચડી જતાં મોત

અમરેલી : સાવરકુંડલા નજીક ગોરકડા ગામે રહેતા અસ્થિર મગજના વૃદ્ધ બધુભાઈ આપાભાઈ વાળા ઉ.વ.૬૦ ગઈ કાલે ગુડઝ ટ્રેનની હડફેટે ચડી જતાં એનું મોત નીપજયું છે.

પાદરીયામાંથી ૮૭ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામ ખાતે અગાઉથી મળેલી બાતમીના આધારે ગઈકાલે રાત્રે દોઢ વાગ્યે તાલુકા પી.એસ.આઈ. ભાટુ અને સ્ટાફે દરોડો પાડીને નગા સરમણ રબારી નામના શખ્સના ઘરેથી રૂ.૨૬,૧૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૮૭ બોટલ ઝડપી લીધી છે. જો કે નગા રબારી આ દરોડા અગાઉ નાસી છૂટ્યો છે. જેને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.

મોરાણામાં પ્રાઈમસ ફાટતાં શખ્સનું મોત નિપજયું

જામનગર : જોડીયાના મોરાણા અને ખંભાળિયામાં અપમૃત્યુના બે બનાવ નોંધાયા છે. મોરાણામાં પ્રાયમસ ફાટતા શખ્સનું મોત થયું હતુ. જોડીયા તાલુકાના મોરાણા ગામે પોતાના ઘેર એકલા રહેતા અને રસોઈ બનાવી રહેલા ભગવાનજીભાઈ પ્રેમજીભાઈ સાકરીયા ઓચિંતો પ્રાયમસ ફાટતાં આખા શરીરે દાઝી ગયા હતા. તાકીદે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત પામેલા જાહેર કર્યા હતા. ખંભાળિયા બસ સ્ટેન્ડ પાસે રહેતા અજય દિનેશભાઈ વાઘેલા નામનો યુવાન પોતાના ઘરે ભુલથી ઉધરસના બદલે ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મોત થયું હતુ.

ચારણ સમઢીયાળામાં ગૌશાળાના લાભાર્થે લોકડાયરો યોજાશે

ચારણ સમઢીયાળા : જેતપુર તાલુકાના ચારણસમઢીયાળામાં ગૌશાળાના લાભાર્થે તા.૧૬ ને શુક્રવારે રાત્રે ૯ કલાકે ગામ સમસ્તના સહકારથી લોકડાયરાનું આયોજન કરાયું છે.જેમાં કલાકારો માયાભાઈ આહિર, હરેશદાન ગઢવી, મનહરદાન ગઢવી, મીનાબેન જાડેજા, શ્રુતિબેન આહિર, વૃષભભાઈ આહિર પોતાની કલાનો લાભ આપશે. ધર્મપ્રેમીજનોને લાભ લેવા જણાવાયું છે.

પાકિસ્તાનથી મુકત થયેલા

૧૫ ભારતીય માછીમારો કાલે વેરાવળથી વતન રવાના થશે

વેરાવળ તા.૧૩ પાકિસ્તાનની જેલમાં સબડતા ૧૫ માછીમારો મુક્ત થતા વાઘા બોર્ડરથી આવતીકાલે વેરાવળ ખાતે ફિશરીઝ કચેરીએ આવી પહોચશે જ્યાં પરિવાર સાથે તેમનું મિલન થતા અશ્રુભીના દશ્યો સર્જાશે. આ માછીમારોમાં સાત દિવ, બે પોરબંદર, પાંચ ઉના અને એક વેરાવળનો સમાવેશ થાય છે.

સાત દિવ, પાંચ ઉના, બે પોરબંદર, એક વેરાવળના માછીમારનો સમાવેશ

વેરાવળ ફિશરીઝ અધિકારી શુકલા, રાડા તેમજ ગઢિયાભાઈ દ્વારા અપાયેલી માહિતી મુજબ પાકિસ્તાન જેલમાં છેલ્લા સાત માસથી સબડતા પંદર માછીમારોને તા.૧૨ના રોજ મુક્ત થતા વાઘા બોર્ડરથી માદરે વતન જવા રવાના થયા હતા જે તા.૧૫ને ગુરૂવારના રોજ વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે આવી પહોચશે. આ માછીમારોમાં દિવના અમૃત જીવા બામણીયા. બાબુ ભીખા બામણીયા. જીવન કરશન બામણીયા, વિજય લખમણ સોલંકી, જીતેન્દ્ર દિલીપ વૈશ્ય, પ્રેમજી રામજી જેઠવા અને ભીખા વરજાંગ બામણીયા, પોરબંદરના લાખા દેવા ભાલીયા, પ્રકાશ સોમા સોલંકી, ઉનાના તડના કાળુ ગોવિંદ વાજા, મનસુખ ઉકા સોલંકી, કારુ રામ વાળા, ઉનાના કાજરડીના સંજય જીવા ચારણીયા, પાલડીના દેવસી મસરી સોલંકી કાજરડીના સંજય જીવા ચારણીયા, વેરાવળના ચુનીલાલ કરશન બામણીયાનો સમાવેશ થાય છે. આવતીકાલે ફીશરીઝ કચેરીથી માદરે વતન જવા રવાના થશે.

મૃત્યુનોંધ

જૂનાગઢ સ્ત્રી નિકેતન વાળા પદ્માબેન શાસ્ત્રીના બહેનનું અવસાન

જૂનાગઢ : બિલખા નિવાસી હાલ મુંબઈ જયેન્દ્રબાળા મહેતા(ઉ.વ.૭૫) તે જવાહરભાઈ એમ. મહેતાના પત્ની તથા સ્વ.ગિરધરલાલ જે. વ્યાસના પુત્રી તેમજ પદ્માબેન બી. શાસ્ત્રી, દિનુભાઈ વ્યાસ અને નટુભાઈના બહેન તથા પ્રકાશ, નયના, મિહિર અને માલિનીના માતુશ્રી તેમજ પાયલ, સાર્થક, જય અને વિરેનના દાદી તેમજ મનન, નિરાલી અને માનસીના નાની તથા નિપા, હિના, ધનરાજ અને મહેશના સાસુનું તા.૧૨ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે બિલનાથ મંદિર, એગ્રી કેમ્પસ રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

જામનગર : મૂળ શેખપાટ નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ જેન્તીલાલ પ્રાણશંકર પંડયાના પત્ની પ્રફુલાબહેન (ઉ.વ. ૬૧) તે અશોકભાઈ, રમેશભાઈ, કિર્તીભાઈ, તથા પ્રફુલાભાઈ પંડયાના ભાભી તેમજ પ્રિતીબહેન એન. યાજ્ઞિક, પૂજાબહેન આર.આચાર્ય, અને નહેલબહેન એસ દવેના માતા તથા રાજુ ત્રિવેદીના બહેનનું તા. ૧૨ના અવસાન થયું છે. ઉઠમણું તા. ૧૬ના સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન શ્રીનગર સોસાયટી, રાજ ચેમ્બર પાછળ, એરોડ્રામ રોડ, જામનગર ખાતે રાખ્યું છે.

જૂનાગઢ : ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ દિવાળીબેન પંડયા (દયાબેન) (ઉ.વ. ૮૨) તે સ્વ. ધીરજલાલ ભગવાનજી પંડયાના પત્ની તથા સ્વ. જયશંકર ત્રિ. વ્યાસના પુત્રી, અભય ડી. પંડયા, કાર્તિદાબેન જોષી, નયનાબેન રાવલ, દર્શનાબેન શુકલના માતા તથા કિશોરકુમાર જોષી, યદુવંદન રાવલ, શૈલેશભાઈ શુકલના સાસુ, આલાપ તથા આયુષીના દાદીમાં તા. ૧૨ ના રોજ સ્વર્ગવાસી થયા છે. ઉઠમણું તા. ૧૫ ને ગુરૂવારે ૪ થી ૫-૩૦ દરમિયાન ગિરીરાજ સોસાયટી નં. ૨ રામેશ્વર મંદિર મધ્યે રાખેલ છે.

રાજકોટ : સોની રાણપરા નિર્મળાબેન (ઉ.વ. ૯૦) તે સ્વ. નરભેરામભાઈના પત્ની, લાલુભાઈ મીનાવાળા, શશીભાઈ, કમલેશભાઈ, ગોપાલ ભાઈના ભાભુ તથા હસમુખ, જીતેન્દ્ર, સુર્યપ્રકાશના મોટા દાદીનું તા. ૧૨ ના અવસાન થયું છે. બેસણું તા. ૧૫ ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ દરમિયાન બોલબાલા મંદિર, ૯, લક્ષ્મીવાડી ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

જૂનાગઢ : વરીયા વૈષ્ણવ પ્રજાપતિ સચાણીયા ગોવિંદભાઈ તેજાભાઈ (ઉ.વ. ૭૨) તે ભરતભાઈના પિતા તથા ભીખુભાઈ વસવેલીયા (જી.ઈ.બી.) સ્વ. રમેશભાઈ, રવજીભાઈ નળિયાપરા (જેતપુર) દિલીપભાઈ લવજીભાઈ (થાન), આશિષભાઈ રવજીભાઈ નાં સસરાનું તા. ૧૩ ના અવસાન થયું છે. બેસણું તા. ૧૬ ને શુક્રવારનાં સાંજે ૪ થી ૬ આઈ.એસ.એ. હોલ, પોસ્ટ ઓફિસ સામે, ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

૧૦૫ વર્ષના હરીબેન જાદવનું અવસાન

વાંકાનેર : ગં.સ્વ. હરીબેન માનસીંગભાઈ જાદવ (ઉ.વ. ૧૦૫) તે કેશુભાઈ ભવાનભાઈ વાઘેલા (રાજકોટ) ના સાસુ, અનીલભાઈ હરીભાઈ પરમાર (મોરબી સેન્ટ્રલ બેંક) નરેન્દ્રભાઈ, યોગેશભાઈ, મહેન્દ્રભાઈ, પ્રતાપભાઈ, મોહનભાઈ પરમાર (એસ.બી.આઈ) તથા ખોડુભાઈ રામજીભાઈ પરમારના ફૈબાનું તા. ૧૩ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૫ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ અનિલભાઈ એસ. પરમારને ત્યાં ગોડાઉન રોડ વિશીપરા "શ્રધ્ધા" વાંકાનેર ખાતે રાખેલ છે.

ઉના : નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ મુળ આમોદરા નિવાસી હાલ ઉનાના હરીશંકર નારણજીભાઈ ઠાકર (ઉ.વ.૭૭) તે સ્વ. જેન્તીલાલ ના નાનાભાઈ તથા અનંતરાય, પ્રવીણભાઈ, સંજયભાઈનાં પિતા તથા કનુભાઈ, જીતેન્દ્રભાઈ (પત્રકાર અમોદરા) ના કાકા તા. ૧૨ નાં કૈલાસ વાસી થયા છે. ઉઠમણું તા. ૧૫ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુર્યમુખી હનુમાન મંદિર ગીરગઢડા રોડ ઉના ખાતે રાખેલ છે.

મોરબી : લુહાર ગોવિંદભાઈ રવજીભાઈ મારૂ (ઉ.વ. ૭૮) તે અશોકભાઈ, દીપકભાઈ, સંજયભાઈ નાં પિતા તથા મકવાણા કાનજીભાઈ પંચાણભાઈ (ધુનડા (શ) વાળા) ના જમાઈનું તા. ૧૨ ના અવસાન થયું છે. બેસણું તા. ૧૫ ને ગુરૂવારે સાંજે ૪ થી ૫.૩૦ દરમિયાન જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે. સસરા પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

વાંકાનેર : મોરબીવાળા મોહનલાલ વલ્લભદાસ મદીયારના પુત્ર ધીરજલાલ (ઉ.વ.૮૦)તે રાજેશ ડી. મણીયારના પિતા તથા આર.એમ. મણીયાર (મોરબી)ના વડીલબંધુનું અવસાન થયું છે. બેસણું તા. ૧૫ના ગુરૂવારે વાંકાનેર ખાતે પેડક વિસ્તારમાં મેઈન રોડ પર તેમના નિવાસસ્થાને સાંજે ૪ થી ૫ રાખેલ છે. તથા તા. ૧૩ને શુક્રવારે મોરબી ખાતે મોઢ વાણીયા જ્ઞાતિની વાડીમાં સાંજે ૪ થી ૫ દરમિયાન રાખેલ છે.

વાંકાનેર : જયંતીલાલ રવિચંદ શેઠ (વિકાસ)ના પત્ની તથા છગનલાલ લીલાધર દોશીના પુત્રી વિજયાબેન મહેતા, દીપાબેન કૌશિક શાહ, ભાવનાબેન મીતેશ ગાંધી તથા હિતેશભાઈના માતા તા. ૧૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૫ના ગુરૂવારે ૧૦.૩૦ વાગ્યે વિશા શ્રીમાળી સ્થાનકવી જૈન ભોજન શાળા દિવાનપરા વાંકાનેર ખાતે રાખેલ છે.

ઉના : નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ મૂળ આમોદ્રા હાલ ઉના નિવાસી ઠાકર મણીશંકર નારણજી (ઉ.વ.૭૭)તે સ્વ. પ્રવિણભાઈ ઠાકર (ઉના પીપલ્સ બેન્ક)ના પિતા તેમજ કનુભાઈ ઠાકર, જીતેન્દ્રભાઈ ઠાકર પત્રકાર આમોદ્રાના કાકા તા. ૧૨ને સોમવારના રોજ કૈલાસવાસી થયેલ છે. સ્વ.નું ઉઠમણું તા. ૧૫ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ સૂર્યમૂખી હનુમાન મંદિર ઉના ખાતે રાખેલ છે.

જૂનાગઢ : નથળીયા ઉનેવાળ બ્રાહ્મણ જયાબેન વસંતરાય મહેતા (ઉ.વ. ૮૨) તે વસંતરાય ગોવિંદજી મહેતાના પત્ની તેમજ દીપકભાઈ મહેતા (નાયબ મેનેજર પુરવઠા નિગમ જામનગર) લલીતભાઈ (એડવોકેટ) યોગેશભાઈ તથા રોહીણીબેન હિતેશ કુમાર જોષી(અમરેલી) ના માતા તા. ૧૨ ના અક્ષરવાસી થયા છે. પ્રાર્થનાસભા તા. ૧૬ ને શુક્રવારે બપોરે ૨ થી ૫ નાથળીયા ઉનેવાળ બ્રહ્મ સમાજવાડી, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

રાજકોટ : મુળ વતન રોજકા હાલ રાજકોટ ના ટેમુભા નાયુબ ચુડાસમા તે જયુભા, જિતેન્દ્રસિંહના પિતા ગિરીરાજસિંહ, શકિતસિંહ, હરપાલસિંહ અને યુવરાજસિંહના દાદાબાપુનું તા. ૧૨ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૬ ને શુક્રવારે ૪ થી ૬ દરમિયાન તેમના નિવાસ "આઈ શ્રી ખોડિયાર"માં બાલાજી પાર્ક, શેરી નં. ૪, કોઠારીયા મેઈન રોડ, શણગાર હોલની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ : અયોધ્યા નિવાસી હાલ રાજકોટના મંગળદાસ ભીખુભાઈ શાહ(ઉ.૮૨) તે રાજેશભાઈ, અનિલભાઈ અને જયેશભાઈના પિતા તા.૧૨ ના રોજ અવસાન પામ્યા છે.બેસણું તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમિયાન, શ્રીરામ કુટિર, મારૂતિનગર-૧, એરપોર્ટ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

અમરેલી : દિવાળીબેન મુળજીભાઈ કાનપરીયા (ઉ.વ. ૮૭) (વિઠ્ઠલભાઈ ખંભાળયાવાળા) તે ધીરૂભાઈ એમ. કાનપરીયા (રીટાયર્ડ આઈ.ટી. ઈન્સપેકટર) ના માતા તા. ૧૨ ના અવસાન થયું છે.

ધારી : ગોવિંદપુર નિવાસી રાજગોર બ્રાહ્મણ મહેતા ઘનશ્યામભાઈ કેશવજીભાઈ (ઉ.૬૮) તે ખોડુભાઈ,સુર્યકાંતભાઈ(પ્રા.શિક્ષક)ના પિતા અને પ્રતિક, પાર્થ ભાવેશભાઈ, નિકુંજના દાદાનું તા.૧૦ ના રોજ અવસાન થયું છે.

જામનગર : કેરાલી(તા.જોડીયા) નિવાસી ગગુબા અનુભા જાડેજા(ઉ.૮૭) તે બળવંતસિંહ (નિવૃત પીએસઆઈ), રણજીતસિંહ(પીઆઈ ઉપલેટા)ના માતા તથા વિજયસિંહ(એસપી કચેરી જામનગર),જયેન્દ્રસિંહ(પીપાવાવ શીપ યાર્ડ)ના દાદીમાનું તા.૧૧ના રોજ અવસાન થયું છે.બેસણું તા.૧૭ ને શનિવારે ૪ થી ૫ દરમિયાન,કેરાલી ખાતે રાખેલ છે.

જેતપુર : જેતપુર નિવાસી મણીબેન મોહનભાઈ મોણપરા (ઉ.વ. ૯૦) તે મોહનભાઈ ઉકાભાઈના પત્ની તથા પરસોતમભાઈ અને પ્રાગજીભાઈ ના માતા તેમજ કપિલના દાદીમાંનું તા. ૧૩ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૬ ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ધોરાજી રોડ પંચવટી સોસાયટીની બાજુમાં શિવનગર - જેતપુર ખાતે રાખેલ છે.

બગસરા : ભલગામ (મોટા) નિવાસી સ્વ. ઠકકર નંદલાલ ત્રિકમજીભાઈ ડોળાશીયાના પત્ની જયાબેન (ઉ.વ.૮૦) તે મોરભાઈનાં ભાભી તેમજ પ્રફુલભાઈ, રાજુભાઈ, દીપકભાઈના માતાનું તા.૧૩નાં સુરત મુકામે અવસાન થયેલ છે. બેસણું તા.૧૭ શનિવાર સાંજના ૪ થી ૬ જલારામ અન્નક્ષેત્ર લાભેશ્વર પોલીસ ચોકી પાસે માતાવાડી વરાછા સુરત ખાતે રાખેલ છે.

સંદેશ news

GTPL, Den પર પણ ઉપલબ્ધ
સેટટોપ બોક્સ માટે ચેનલ નંબર આ મુજબ છે
GTPL Digital 268/ Analog- S-3,
DEN NET Digital 80/ Analog- off/ Analog U-51

આજે સંદેશ ન્યૂઝ પર નિહાળો

સવારના ૬.૩૦થી ૯ કલાકે

સમય	પ્રોગ્રામ
૦૬:૩૦	ગુરુવચન
૦૭:૦૦	ન્યૂઝ @ 7 am
૦૭:૩૦	આજનો મહિમા
૦૮:૦૦	સુપ્રભાત ગુજરાત
૦૮:૩૦	બિઝનેસ સંદેશ

સવારના ૯ થી ૧૨ કલાકે

સમય	પ્રોગ્રામ
૦૯:૦૦	ન્યૂઝ એક્સપ્રેસ
૦૯:૩૦	લાઇટ્સ કેમેરા એક્શન
૧૦:૦૦	ન્યૂઝ @ 10 am
૧૦:૩૦	સ્પેશિયલ રિપોર્ટ
૧૧:૦૦	ન્યૂઝ @ 11 am
૧૧:૩૦	સિટી લાઇફ

બપોરે ૧૨ થી ૩ કલાકે

સમય	પ્રોગ્રામ
૧૨:૦૦	ન્યૂઝ @ 12
૧૨:૩૦	ખબર ગુજરાત
૧:૦૦	ન્યૂઝ @ 1 pm
૧:૩૦	ખાના-ખજાના
૨:૦૦	ન્યૂઝ @ 2 pm
૨:૩૦	ક્રાઇમ એલર્ટ

બપોરે ૩ થી ૬ કલાકે

સમય	પ્રોગ્રામ
૩:૦૦	ન્યૂઝ અપડેટ
૩:૧૫	વુમન સ્પેશિયલ
૩:૩૫	ધ હેલ્થ શો
૫:૩૦	બિઝનેસ સંદેશ

સાંજે ૬ થી ૯ કલાકે

સમય	પ્રોગ્રામ
૬:૦૦	સિટી લાઇફ
૬:૩૦	સ્પોર્ટ્સ
૭:૦૦	ન્યૂઝ એક્સપ્રેસ
૭:૩૦	ખબર ગુજરાત
૮:૦૦	ન્યૂઝ @ 8 pm
૮:૩૦	મેટ્રો ન્યૂઝ

રાત્રે ૯ થી ૧૨ કલાકે

સમય	પ્રોગ્રામ
૯:૦૦	એક્સ્ટ્રા કોમેન્ટ
૯:૩૦	એક્સ્ટ્રા કોમેન્ટ
૧૦:૦૦	ન્યૂઝ @ 10
૧૦:૩૦	સ્પેશિયલ રિપોર્ટ
૧૧:૦૦	લાઇટ્સ કેમેરા એક્શન
૧૧:૩૦	ક્રાઇમ એલર્ટ
૧૨:૦૦	ન્યૂઝ @ 12 am

જોવાનું ચૂકશો નહીં

- પ્રસિદ્ધ જ્યોતિષ બેજાન દારૂવાલા જણાવશે તમારૂ આગામી વર્ષ કેવું રહેશે.

જુઓ આજે સંદેશ ન્યૂઝમાં સાંજે ૪ થી ૫

સેમિનાર, સભા, સમારંભ જેવા કાર્યક્રમોની માહિતી ચેનલ પરથી પ્રસારિત કરવા નીચેના સરનામે પ્રેસનોટ, ફોટોગ્રાફ્સ, આમંત્રણ પત્રિકા, માહિતી વગેરે મોકલવા વિનંતી

સંદેશ ટેલિકાસ્ટ, સંદેશ ભવન, લાડ સોસાયટી રોડ, પો.ઓ.બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪, ટેલિફોન નંબર- ૦૭૯ ૪૦૦૦ ૪૦૦૦, ફેક્સ નંબર-૦૭૯ ૪૦૦૦ ૪૨૦૫, ઇ-મેઇલ આઇ.ડી. info@sandeshnews.tv

ફટાકડાના સ્ટોલના પૈસા બાબતની માથાકૂટમાં

જામનગરમાં ચાર શખ્સોને દૂકાનદારને ઢીબી નાખ્યો

મારી નાખવાની ધમકી આપ્યાની પણ ફરિયાદ

જામનગર,તા,૧૨ : જામનગરની ખોડીયાર કોલોનીમાં ફટાકડાના સ્ટોલના પૈસા બાબતે ચાર શખ્સોએ દૂકાનદારને ઢીબી નાખતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ખોડીયાર કોલોનીમાં ફટાકડાનો સ્ટોલ નાખીને બેસેલા જયસુખ મુળજીભાઇ ચૌહાણના સ્ટોલમાં ફટાકડા લેવા પૃથ્વીસિંહ, ધર્મેન્દ્રસિંહ ભૂપતસિંહ, દીગુભા પ્રતાપસિંહ, જયપાલ જાડો નામના શખ્સો ગયા હતા. ફટાકડા લઇ હિસાબ કરતી વખતે માથાકુટ થતાં ચારેય શખ્સોએ ઢીકાપાટુનો માર મારી પોલીસને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ચાલ્યા જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગરમાં વિરલબાગ પાસે

બૂટલેગર અને પોલીસ વચ્ચે ઝપાઝપી, પીએસઆઈને ઈજા

કાર લઈ બૂટલેગર નાસી જતાં ફરિયાદ નોંધાવાઈ

જામનગર : વિરલબાગ પાસે કારમાં કથિત રીતે દારૂ લઈને નિકળેલા શખ્સને પીએસઆઈએ આંતરી તપાસણી કરવાનું કહેતા ગરાસીયા શખ્સે ઝપાઝપી કરી ગાડી સાથે નાશી છુટતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિરલબાગ આગળ દાદા દાદી ગાર્ડન પાછળ ખાંચામાં પેટ્રોલિંગમાં રહેલા પીએસઆઈ ગીરીશ વાઘેલાને શંકા જતાં ઈન્ડીકા વિસ્ટા કારમાં રહેલા દિગુભા જાડેજાને કાર ચેક કરવાનું કહેતા દિગુભાએ 'તુ દારૂનો ધંધો કરવા દેતો નથી, આજે તને મારી નાખવો છે' તેમ કહી ફરજમાં રૂકાવટ કરી પીએસઆઈ સાથે ઝપાઝપી કરી કાર સાથે ઢસડી આંગળીઓમાં ઈજા કરી નાસી છૂટતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગર-મીઠાપુરમાં બે સ્થળે તસ્કરોનો હાથફેરો

જામનગર : મીઠાપુરમાં ચોરીના બે બનાવમાં ચોરીના બે બનાવમાં તસ્કરોને રૂ. એક લાખ છ હજારનો ધનલાભ થયો હતો. જામનગરમાં નેશનલ પાર્કમાં રહેતા ઈમરાન સતારભાઈ પોપટપોત્રાના ઘરના તાળા તોડી કોઈ ઈસમ સોનાના પાટલા આશરે રૂ. એક લાખની કિંમતના સાડા ત્રણ તોલાના ચોરી જતાં પોલીસમાં ફરિયાદ થઈ છે. મીઠાપુર ટાટા કંપની ટાઉનશીપ વિસ્તારમાં કોઈ શખ્સ બુસ્ટર કંપની સાથે લાગેલા એલ્યુમિનીયમના કાળા કલરના રૂ. છ હજારની કિંમતના વાયર ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ થઈ છે.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com